



Axel Polymers Limited

Regd. Office & Works : 309, Mokshi, Sankarda-Savli Road, Tal. Savli,
Dist. Vadodara - 391780, India. • Telefax : +91-2667-244395, 244438
info@axelindia.com • www.axelindia.com • CIN : L 25200GJ1992PLC017678

15.11.2019

To,
The Asst. General Manager,
BSE Ltd. 25th Floor,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort
Mumbai – 400 001

BSE Scrip Code - 513642

Dear Sir,

Sub: Newspaper Cutting of the Extract of Unaudited Financial Result as on 30.09.2019.

Ref: Intimation under Regulation 47(1) (b) of SEBI (LODR) Regulations, 2015.

Dear Sir,

Please find enclosed herewith Photocopy of the Newspaper Cutting of the Extract of the Unaudited Financial Results for the Quarter and Half Year ended 30th September 2019 published in the Business Standard Newspaper Ahmedabad Edition and Loksatta Jamsatta Gujarati Newspaper Vadodara Edition in English language on Friday, 15.11.2019.

Kindly take the above on your record and acknowledge the same.

Thanking you,

For Axel Polymers Limited


Jigardan Gadhi
Company Secretary



Iron ore prices have fallen 13% in the past one month after inventory levels turned from deficit to surplus at Chinese ports. With the ongoing slowdown in the global economy weighing on infrastructure spends, and thereby, steel demand, iron ore prices are likely to remain subdued over the medium term

"It's been a stock picker's market for some investors and their 'pat my back friends'. Almost all their stocks are down 50% and more. Wonder what skill they use(d)? Keep scratching - the head!"
BASANT MAHESHWARI,
 Author & Portfolio Manager



Consumer discretionary gets leg up as investors chase quality

Earnings multiple of consumer durable firms at 3.5-year high

KRISHNA KANT & ASHLEY COUTINHO
 Mumbai, 14 November

Equity investors coming to the rescue of India's consumption demand story have pushed up the valuation of consumer discretionary stocks to their highest in three and half years. This is despite a sharp deterioration in firms' fundamentals over the latest quarter.

These consumer durable stocks are trading at 24.6x their trailing 12-month profit before tax (PBT) on an average, up from a price-to-earnings (P/E) multiple of 21.7x at the end of June and 20.6x a year ago.

The current valuation is just a notch below the peak of 27.7x the trailing PBT at the end of the December 2017 quarter.


The combined market capitalisation of 29 consumer durable players in the *Business Standard* sample has risen 6.9 per cent year-on-year (YoY), despite a 28 per cent YoY decline in profit before tax (PBT) in Q2FY20 and 8.3 per cent YoY decline in net sales. The industry PBT has contracted for three consecutive quarters.

This is the worst show by the industry in the last five years. Q2FY20 was the first in the last five years



LOOKING FOR VALUE

Valuations continue to soar even as sales and profitability come under pressure
 Consumer discretionary stocks



Note: Net sales, profit before tax growth and P/E on trailing 12-month basis
 Source: Capitaline; Compiled by BS Research Bureau

when the companies included in the sample reported YoY contraction in revenues.

The analysis is based on quarterly revenues, profits, and market capitalisation of listed firms in industries such as passenger cars, two-wheelers, domestic appliance makers, jewellers, paints and home product companies, and fashion retailers. The sample has factored in firms to have declared their results.

Among major companies in the sample are Maruti Suzuki, Hero MotoCorp, Bajaj Auto, Titan, Asian Paints, Berger Paints, Mahindra & Mahindra, Eicher Motors, Havells India, Kajaria

Ceramics, and Blue Star.

Analysts attribute this growing divergence between valuation and fundamentals to the TINA or 'there is no alternative' factor for investors.

"I agree that most consumer durable stocks are trading at unsustainably high valuations. However, there are few alternatives in the non-consumer space," says G Chokkalingam, founder and MD of Equinomics Research & Advisory Services.

However, he clarified that valuations of many stocks are approaching the bubble, and are not sustainable, given their earnings trajectory. "Valuations in the consumer space may correct sharply, once there are broad-based economic growth returns that will push up earnings in

cyclical sectors such as corporate banks, capital goods, and commodity manufacturing," said Chokkalingam. Others attribute this to a combination of a fall in interest rates globally and the focus on corporate governance and quality stocks.

"Thanks to record low interest rates, investors are looking for quality stocks that provide steady earnings yield. Most of the consumer discretionary players fit the bill as they are debt-free and generate good free cash flow," said A K Prabhakar, head (research), IDBI Capital.

The slowdown is bound to hit profitability of some of these firms. However, earnings will rebound once growth picks up, and valuations may start to look somewhat reasonable.

Analysts say that in the current market scenario, ratios such as P/E and price-to-book may matter less, as the market is fundamentally driven by liquidity-chasing quality and yields. What is more important is assessing the return on equity, return on capital employed, and overall growth potential.

Analysts added that the outlook on consumer demand was brighter than other demand drivers such as corporate capex and infrastructure segment.

"In this phase where growth has been difficult to come by, investors have found solace in firms that are growing to at least a small extent. Second, in the last one and half years, there has been a string of bad news on companies with debt. Consumer companies don't have these issues," said Sunil Singhania, founder of Abakus Asset Manager.

'Broking industry is no longer about pricing'

In less than a decade, Zerodha has managed to become the No. 1 player in terms of the number of active clients in the broking space. In an interview with Samie Modak, NITHIN KAMATH, founder and chief executive officer of the tech start-up - which disrupted the industry with zero-brokerage plans - says the industry has moved away from pricing to product offerings. Edited excerpts:

How did Zerodha manage to crack the broking industry?

We got lucky. We didn't get enough competition along the way. We think of us as a tech business; this whole broking thing is incidental. An apple-to-apple comparison would be a tech company doing broking.

Demonetisation also provided an impetus. Earlier, on-boarding a customer was the biggest challenge. This Aadhaar-based know-your-customer made it really easy. That's the only reason we came on the scene.

Established players leveraged their physical presence. A digital-only player would never have been able to match that. Once that thing was broken, it was easy for someone like us to disrupt the place.

Zerodha is criticised for frequent outages.

The issue is blown out of proportion. In the last 14 months, we have had three incidents. Google, Facebook or Amazon would have had more incidents. I don't think any tech business is insulated from this. But the problem with our business is when we are down, we are causing a notional profit or a loss. Also, our client base is young and social media savvy and hence, these things get amplified.



Zerodha has the maximum number of active clients. What is your revenue market share?

The industry size is between ₹8,000 crore and ₹10,000 crore. Exchange transaction charges get added to the revenues. But if you take out that, last year we did around ₹700 crore, which included proprietary trading (prop). This year, we will do around ₹800 crore of pure retail broking, excluding prop.

Q&A

Now that you have established yourself, is there a temptation to raise charges?

We are thinking of premium offerings and certain new products. We are working hard at the backend. A lot of people think the broking business is about pricing. It

has stopped being about pricing long ago. It is all about products. Product development takes time. We have taken four-five years. Most new players used vendor-based products.

We have only a few stock market participants.

The real question is how many of the 1.3 billion people make money. People who trade will be ones who make money. The entire audience for the industry is not more than 50 million. That is a stretch. So the participants are around 7 million, which is 14 per cent of the addressable market. I'd say that's not so bad.

Any plans to go public?

As a business, we don't require money. But people in our office have stock options. We need to give them liquidity at some point in time. Our fortunes are closely tied to the stock markets. We are like a high-beta stock. With so much volatility in our business, raising money from the public could be a challenge. We need to build other verticals that will take away some of this volatility. We have a non-banking financial company licence. We are starting loan-against-securities and margin funding.

More on business-standard.com

EM ETFs get \$1-bn inflows for 2nd week

SAMIE MODAK & BLOOMBERG
 Mumbai, 14 November

Stocks, particularly in emerging markets (EMs), are witnessing a surge in passive flows.

Last week, inflows into the US-listed EM exchange traded funds (ETFs) were more than \$1 billion for the second consecutive week. According to Bloomberg data, investors poured in \$1.06 billion into EM ETFs, which invests in developing countries including India. In the previous week, flows stood at \$1.06 billion.

Flows for the week ended November 8 were most since February 22 - also the fifth straight week of inflows.

The positive flows have boosted the performance of

EMs. The MSCI EM index has gained as much as 9 per cent since October 1, only to give up some of its gains over the past few sessions.

Analysts say optimism around a trade deal between the US and China has boosted risk sentiment. However, renewed uncertainty triggered by US President Donald Trump's threat of further tariff hikes on Chinese imports has weighed on EM performance.

Weak performance of the Chinese and Hong Kong markets, which have the biggest weight in the EM index, has also affected the index.

However, Chinese and Hong Kong equities have been the biggest beneficiaries of the surge in ETF flows.

Stocks belonging to these two countries cornered a third of the EM ETF flows.

India got a minuscule portion of the ETF flows at just \$36 million. However, total foreign flows into domestic equities for the week ended November 8 stood at \$1.1 billion. Analysts said the bulk of these flows were on account of strategic investments made by overseas investors.

Among individual ETFs, BlackRock's \$27-billion iShares MSCI Emerging Markets ETF received \$354 million, the biggest inflow since February. Its bonds counterpart, the \$14.9-billion iShares JP Morgan USD Emerging Markets Bond ETF had a \$326-million inflow.

HEALTHY FOREIGN FLOWS

ETF flows into EMs were robust last week

	Week flow	Equity	Debt	Total assets (\$ bn)
Total for EMs	1,059.7	736.2	323.6	266.2
Americas	141.7	39.6	102.1	43.3
Asia-Pacific	658.8	591.4	67.5	176.9
EMEA	259.2	105.1	154.0	46.0
Report card				
China/Hong Kong	315.6	310.4	5.2	79.4
Taiwan	107.8	107.8	0.0	28.9
Brazil	35.0	19.5	15.5	26.2
India	37.5	36.1	1.4	25.9
South Korea	47.8	46.4	1.4	17.6

Note: Data for US-listed EM ETFs; for the week ended November 8; EMEA is Europe, Middle East and Africa Source: Bloomberg

THE COMPASS

High-flying SpiceJet loses speed over rising costs

Pressure on yields set to continue in December qtr

RAM PRASAD SAHU

SpiceJet's 51 per cent increase in revenues to ₹2,845 crore in the September quarter was driven by a sharp increase in passenger volumes and a marginal uptick in yield.

The airline's capacities increased by half in the quarter, while passenger volumes rose 29 per cent over the year-ago period.

However, what belied hopes of the Street was the muted increase in yields at 1.9 per cent, compared to the 3.5 per cent estimated by the Street. IndiGo's passenger yields, in comparison, rose 9.4 per cent.

According to analysts at JM Financial, SpiceJet's below-par yield increase was due to a significant increase in fleet during the first half of FY20, which impacted its route opti-

misation efforts.

The pressure on yields is expected to continue throughout the current quarter (Q3). While Q3 is a traditionally a strong quarter, flash sales by airlines and a fall in prices in metro cities indicates flat yields for the sector. This doesn't bode well, especially at a time when costs are rising for both IndiGo and SpiceJet.

The 51 per cent increase in expenses (excluding rental and fuel) for SpiceJet and 32 per cent for IndiGo has negated the gains in the top line.

Higher scale of operations led to a surge of 56 per cent in employee costs for both carriers. Maintenance costs surged for both IndiGo and SpiceJet in Q2, and is expected to continue (especially for IndiGo) for the next few quarters. Both

posted a loss at the operating level.

Even though the reported loss by SpiceJet, at ₹462 crore, was much higher than analyst estimates, the figure would have been even higher by ₹180 crore had the company not recognised reimbursements from Boeing related to the grounding of the 737 MAX.

The higher losses, pressure on yield in the current quarter, and a cut in target prices, all led to a 6 per cent drop in the SpiceJet stock.

Brokers, however, prefer the smaller airline given the valuation concerns. IndiGo, SpiceJet will gain from higher load factors and fuel efficiency once the 737 MAX returns to its fleet in Q1FY21.



Merger a weak link for BoB on asset quality concerns

Higher slippages, flat loan growth add to worries

HAMSINI KARTHIK

Mergers take time for results to get reflected in the books. In the case of banks, the timeline could be stretched further given the unpredictable nature of asset quality. This held true for Bank of Baroda's (BoB's) September quarter (Q2) results too.

With the management being focused towards integration of the merged entity, BoB posted the weakest show by any bank in Q2. Loans grew a mere 2 per cent, as the bank worked towards reducing its corporate loan book.

The unnerving factor, though, was that of asset

quality. The metric showed little signs of easing in the case of BoB, a deviation from the trend witnessed across the sector.

With the gross non-performing asset (NPA) ratio firm at 10.3 per cent (near the June quarter's level), and net NPA ratio at 3.9 per cent, analysts at PhillipCapital say the merger-related integration will take precedence over a turnaround, in the eyes of the management.

Further, slippages (loans turning bad) remaining elevated at ₹7,300 crore, or 4.6 per cent of the total loan book in Q2, shows asset quality is unlikely to improve in

the near term.

BoB has earmarked ₹14,500 crore of loans as potentially troublesome accounts (watch-list), though the overall list of stressed assets reduced marginally to ₹84,470 crore in Q2.


With the bank not providing for two key accounts that could turn troublesome in the ongoing quarter (DHFL and Suzlon), Nomura says credit cost for FY20 may remain elevated at 230 basis points.

However, the silver lining was the improvement in domestic net interest margin (NIM) to 2.92 per cent from 2.8 per cent a year ago. This

was led by a rise in the share of low-cost current account-saving account (CASA) deposits to 33.6 per cent, from 28.9 per cent last year.

In addition, retail loans - led by home and auto loans - grew 16 per cent year-on-year, keeping BoB on track in shrinking its corporate exposure.

With asset quality taking precedence, the BoB stock is slowly losing appeal. From 25 'buy' recommendations a year ago, the number has dipped to 22 (despite the benign 1x FY21 estimated book value). The stock has shed 3.3 per cent after the Q2 results.



Axel Polymers Limited

CIN: L25200GJ1992PLC017678
 Regd. Off: S. No. 309, Vil. Mokshi, Tal Savli, Dist Vadodara 391780
 Telefax: +91 266 7244395, Website: www.axelindia.com
 Email: cs@axelindia.com

Extract of Unaudited Financial Results for the quarter ended 30.09.2019

Sr. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended	
		30.9.2019		30.9.2018			31.3.2019
		Unaudited	Unaudited	Unaudited	Audited		
1	Total Income from Operations	529.26	618.73	1073.64	1234.35	2437.4	
2	Net Profit / (Loss) for the period (before Tax, exceptional and/or Extraordinary items)	-30.24	20.67	3.68	42.50	43.49	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-30.24	20.67	3.68	42.50	43.49	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-30.24	20.67	3.68	42.50	46.81	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-30.28	20.74	3.58	42.99	46.84	
6	Equity Share Capital	430	430	430	430	430	
7	Reserves as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-236.83	
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) -						
	1. Basic:	-0.70	0.48	0.09	0.99	1.09	
	2. Diluted:	-0.70	0.48	0.09	0.99	1.09	

Note: The above is an extract of detailed format of Financial Results filed with Stock Exchange, the full format of Financial Results are available on the Company's website as well as on the stock exchanges' website www.bseindia.com.

For Axel Polymers Limited
 Sd/
 Gaurav Thanky
 Managing Director
 DIN: 02565340

Place: Mokshi
 Date: 13.11.2019

GILADA FINANCE AND INVESTMENTS LIMITED

CIN: L65910KA1994PLC015981
 Regd. office: # 105 R R Takt, 37 Bhoopasandra Main Road, Bangalore- 560094
 Ph : 080-40620000(30 lines) Fax: 080-40620008, Email: md@giladagroup.com, Website: www.gfl.co.in
 (Standalone Unaudited Financial Results for the Quarter & Half year ended on 30th September, 2019)
 [Regulation 47(1), (b) of the SEBI (LODR) Regulations, 2015] (Rs. in Lakhs)

Sl. No.	Particulars	Quarter Ended 30.09.2019 (Unaudited)	Half Year Ended 30.09.2019 (Unaudited)	Quarter Ended 30.09.2018 (Unaudited)
1.	Total Income from Operations	83.74	169.09	85.97
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	33.01	74.60	29.27
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	33.01	74.60	29.27
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	23.72	54.45	21.14
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	23.00	53.01	21.31
6.	Equity Share Capital	351.23	351.23	351.23
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year (Note c)	855.96	855.96	855.96
8.	Earnings Per Share :			
	1. Basic:	0.65	1.51	0.61
	2. Diluted:	0.65	1.51	0.61

Notes:-
 a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the websites of the Company at www.gfl.co.in and the Stock Exchange at www.bseindia.com.
 b) Above results have been reviewed by the Audit Committee and were considered and approved by the Board of Directors at their meeting held on 14.11.2019.
 c) Reserves (excluding Revaluation Reserves) as shown of the previous year ended Mar 31, 2019 as per Previous GAAP.

For GILADA FINANCE AND INVESTMENTS LTD.
 Sd/- (Rajgopal Gilada)
 Managing Director, (DIN: 00307829)

Place : Bangalore
 Date : 14.11.2019

વિદેશ સમાચાર

ટ્રમ્પ મહાભિયોગ : કેમોકેટિકોની વધુ ૮ સાક્ષીઓની યાદી જાહેર

વોશિંગ્ટન. અમેરિકાના કેમોકેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના મહાભિયોગના સંદર્ભમાં વધુ આઠ સાક્ષીઓની યાદી જાહેર કરી છે. આ સાક્ષીઓ જાહેર સુનાવણીમાં ગવાહી આપશે. આંધર્માં નવાસ દરમિયાન એક બેંચ કમરમાં આ સાંસદોના બધાને રોકી દેવા હતા. પ્રતિનિધિસભામાં બહુમતિ ધરાવતા કેમોકેટિક સાંસદોમાં નવાસ શરૂ કરી હતી. ટ્રમ્પ પર એ આક્ષેપ મુકવામાં આવ્યા છે કે તેમણે પોતાના પ્રતિસ્પર્ધી કેમોકેટ અને ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંબંધિત ઉમેદવાર જો બિલ્ડન માટે અગ્રણ્ય સૂચનામાં આપવા પુકેન પર દબાણ લીધું કેવા પોતાના હોદાનો દુરુપયોગ કર્યો હતો. આ કેસમાં ઉલ્લા મતદાન અમેરિકી સેનેટ કરશે જોઈ રિપબ્લિકન બહુમતિમાં છે તેથી મોટા મતો મેળવવાનું અસંભવ છે. પુકેનમાં અમેરિકાના પુરૂ રાજ્યનું ચેરી થાનાનો કેસુકાર હાજર થાય તેની સંભાવના છે.

પ્લાસ્ટિકના પક્ષીઓ ગોઠવી ઇર્ધ તળાવની માછલીઓને સુરક્ષા અપાઈ

ન્યુપોર્ક. અમેરિકાની સિલિકોન વેલીના સોલ્ટપોન્ડમાં રહેલી માછલીઓની પ્રજાતિને બચાવવા માટે તળાવના કિનારા પર ટુવિમ અને પ્લાસ્ટિકના પક્ષીઓ મુકવાની કાર્ય શરૂ કરી છે. વાત એમ છે કે, આ તળાવ પર કાચાના વર્ષના પ્લાસ્ટી પક્ષી કેરિયન ટર્નના ધાર્ડ ખાસ સોનામાં ઉતરી આવે અને તેનો આ તળાવમાં રહેલી અને જેની જાતિ વિલુપિતના આર છે એવી માછલીઓનો શિકાર કરે છે. હવે વેપારી પક્ષીઓને જાસવા એ આવીના કાચામાં વિરુદ્ધ છે. જ્યારે માછલીઓની આ પ્રજાતિને પણ કાચાનું રક્ષણ મળેલું છે. આગ્ર્ય કોર્ટિયા વિસ્તાર સુરક્ષિત તળાવો માટે જાણીતું છે. અહીં તળાવોના કારણે મરુત્વવાળા બિલા છે તેથી સાંકડા પ્રજાતિની માછલીઓ પર જોખમ છે. આવી તજ્જોએ એક ઉપાય સોંપ્યો અને સોલ્ટપોન્ડના કિનારાની આસપાસ કેરિયન ટર્નની પ્લાસ્ટિકની પ્રતિકૃતિઓ બનાવીને ખસડી દીધી છે. કેરિયન ટર્ન પક્ષીઓની વિશેષતા એ છે કે જો તેઓ જુએ કે અહીં પહેલેથી જ પોતાની જાતના પક્ષીઓ વડેલા છે તો તેઓ અન્યથા ચાલ્યા જાય છે. આમ કરવાથી માછલીઓને ઉચિત સુરક્ષા આપી શકાઈ છે.

સ્વોવેકિયામાં ભસ-ટૂક અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત ૧૨ લોકોનાં મોત

નિના. પશ્ચિમ સ્વોવેકિયાના પર્વતીય પ્રદેશમાં વિદ્યાર્થીઓને લઈ જતી એક પબ્લિક બસને પથ્થરો અને રેતી બેરીલીટુ સાથે અકસ્માત થતાં કેટલાક વિદ્યાર્થીઓ સહિત ૧૨ જણનાં મોત નીપજ્યાં હતાં. ધરા-બુધવારે સ્થાનિક સરકારે બસને ૧ વાગે નિના શહેરના પાસે વિસ્તારમાં બની હતી. બ્રેકિંગના ઘટના બંધાઈ ૮૦ કી.મી. દૂર છે. આ વિસ્તારમાં આવી પહોંચતા બસની સામાન્ય હોઈ આ મારને ઉભરો તરીકે સ્થાનિક સંબંધને છે. પથ-સરળેથી મળેલી નસલીઓ અનુકરણ ટૂક રસ્તા પર આવી પહોંચી હતી અને માર્ગ પર સીને અને પથ્થરો વેરેલા હતા. જ્યારે બસ દૂર રસ્તાની આગળ આવી પહોંચી હતી હતી. નિનાના કાચર સિનેટના અધિકારીએ જણાવ્યું હતું કે, આ મોટામાં ને કિશોર વયના સેકેન્ડરી સ્કૂલમાં ભણતાં બાળકો નિયમિત મુશ્કેલી કરતાં લોપ છે. અકસ્માતનું કારણ શ્રદ્ધાચૂક નથી.

પંડિત જવાહરલાલ નહેરૂને મોટી અને સોનિયા ગાંધીની શ્રધ્ધાંજલિ સોનિયા ગાંધીએ સમાધી સ્થળ શાંતિવન જઈને શ્રદ્ધાંજલિ આપી

નવીદેહી. તા. ૧૪ ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનો આજે જન્મ દિવસ છે. ભારતે તેમના જન્મ દિન નિમિત્તે મોટી અને કોરેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોટીએ દ્વીટ કરીને નહેરૂને યાદ કર્યું અને સોનિયા ગાંધીએ તેમના સંઘર્ષી સ્વર્ગ શાંતિવન જઈને પુષ્પાંજલિ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી. સોનિયા ગાંધી સિવાય મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી, પૂર્વ રાષ્ટ્રપતિ ડોમિંગ એસ્ટ્રી સહિત પણ ગણરામ લોકેશને પણ નહેરૂને શ્રદ્ધાંજલિ આપી હતી. મોટીએ દ્વીટ કરીને કહ્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાનને તેમના જન્મ દિવસ પર શ્રદ્ધાંજલિ

વીડિઓ-ફોટો એક્સપો કેનેડાના ટોરેન્ટો ખાતે પ્રો-ફ્યુઝન એક્સપો ૨૦૧૯નું આયોજન



ફોટોગ્રાફી દુનિયાનું આઈપેપ હવુ આખા વિશ્વમાં સદી પહેલાં હતું તેવું જ છે. તેમાં પણ ડિજિટલ ટેકનોલોજીના રમણન પછી તો આ લેખમાં પોપોળ લલીની સોધ થયા છે. હવે મોબાઇલ ફોનમાં જ મુવી કેમેરા હોવાથી લાભોટા બધા જ ફોટોગ્રાફરો બની બેઠા છે. ટોરેન્ટો ખાતે યોજાયેલા હે વિડિયો વીડીયો ફોટો એક્સપોમાં ફોટોગ્રાફી માટેના કેમેરા, લેન્સો, ટેલિસ્કોપ, વગેરેની ઝાલેક હાંડ રહુ કરવામાં આવી હતી.

દેશના બધા રાજ્યોમાં પ્રોપર્ટી બજારમાં મંદી પણ અચોધ્યામાં તેજીનો માહોલ છવાયો અચોધ્યાની જમીનની કિંમતમાં રોકેટ ગતિથી નોંધાયેલો ઉછાળો

પ્રવાસીઓ માટે શ્રેણીબદ્ધ નવી સુવિધાઓ વધારાશે : અચોધ્યા ખાતે હવે સ્ટાર હોટેલ બનશે

અચોધ્યા, તા. ૧૪ એકબાજુ સમગ્ર દેશમાં પ્રોપર્ટી માર્કેટમાં જોરદાર મંદી શેવા મળી રહી છે. ખીજી બાજુ રામજન્મભૂમિનો વિવાદ ઉદ્ભવેઈ ગયા બાદ અચોધ્યામાં જમીનના ભાવે રોકેટગતિથી આસમાને જઈ રહ્યા છે. આ સ્થિતિ હજુ કેટલાક વર્ષો સુધી જાદી રહી શકે છે. અચોધ્યામાં પહેલાથી જ પ્રોપર્ટી ધરાવનારને હવે જોરદાર કાયદો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટનાં સુપ્રાનવી ચરૂ થયા બાદ ૧૪ મંત્રી પેટિકમા ભેગમાં ૭૦૦થી વધીને ૧૫૦૦ રૂપિયા પ્રતિ સેંચવાર જમીનના ભાવ વધે ગયા છે. મુઝીરોકામાં જોરદાર ચલ આવી ગઈ છે. પ્રવાસીઓ માટે સુવિધ વધારી દેવામાં આવી રહી છે. અચોધ્યામાં મોટી અને



બવ્ય હોટેલ તૈયાર કરવાની દિશામાં પણ નવી નવી પહેલ કરવામાં આવી રહી છે. અચોધ્યામાં વિવાદ થયા બાદ વિકાસની ગતિ લગભગ રોકાઈ ગઈ હતી. આ બાબતનો અંદાજ આનાથી વગાવી શકાય છે કે સમગ્ર જિલ્લામાં એનેક પછ રસ્તાર

લોટેલ નથી. પ્રોપર્ટી ડિવેલોપરની વાત પણ વિચાર કરવામાં આવે તો ઉલ્લા મતદાન પ્રતિનાના ગાળામાં અચોધ્યામાં જમીનની કિંમતે સતત મંદી રહી છે. હજુ ડિવેલોપર પાસે થઈ શકે છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના હોટેલ રિસોર્ટ અને વિમાની મથકનું

નિર્માણ કરવામાં આવનાર છે. સૌથી પ્રવાસી અધિકારી આવી પાંચવાન કહેવા મુજબ અચોધ્યા વિવાદના કારણે અહીંના ૧૦ મોટા પ્રોજેક્ટ નોંપણી બાદ અટકાઈ પડ્યા હતા. જો કે હવે તમામ મોટા પ્રોજેક્ટ આંતરની તમામ તકલીફો દૂર થઈ ચુકી છે. મંદિર મામલે તમામ બાબતો પર નજર રાખી રહેલા કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે આગામી વર્ષે ખીજી એપ્રિલા દિવસે બનવાના રામના જન્મદિવસે લગ્ન નવમીના પ્રસંગે એક ખાસ પ્રકારમાં બવ્ય રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરના હોટેલ અને રિસોર્ટ તેમજ હજુ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકાસ કરવાની પણ તૈયારી છે.

ભાજપના ૮, જેજેપીના ૧ અને ૧ અપક્ષ ધારાસભ્યએ શપથ લીધા હરિયાણામાં ખટ્ટર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ : ૧૦ મંત્રીઓએ શપથ લીધા

ચંડીગઢ, તા. ૧૪ હરિયાણાની ૧૪મી વિધાનસભાના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ચુરુવારે કરવામાં આવ્યું છે. તેમાં ૬ કેબિનેટ અને ૨ રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે. શપથસ્થાન સમર્વેલ નાણાસહ અધ્યક્ષે દરેક મંત્રીઓને શપથ આપવા છે. તેમાં ભાજપના ૮, જેજેપીના ૧ અને ૧ અપક્ષ ધારાસભ્ય રજીસ્ટર સિંઘ સીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં ૪૦ સીટ જીતના ભાગમાં ૧૦ સીટ વાળી જેજેપી અને ૦ અપક્ષ ધારાસભ્યોના સમર્થકોથી સરકાર બનાવી છે.



શ્રમ અને રોજગાર વિભાગ, નાગરિક તેમજ ઉચ્ચત વિભાગ, લોક નિર્માણ વિભાગ, વિકાસ તેમજ પંચાયત વિભાગ, સારાનત સંક્રમણ વિભાગ, પુનવસ વિભાગ જેવા વિભાગ આપ્યું છે. જ્યારે ગૃહ, નાણાં, કૃષિ, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ જેવા મહત્વનાં વિભાગ ખીજીથી પાસે રહેશે.

કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા અનિલ વિજ, કવરપાલ ચુર્જ, મુખ્યમંત્રી શર્મા, રજીસ્ટર સિંઘ, જયકાશ, બનાવરીલાલ રાજ્યમંત્રીના શપથ લીધા ઓમપ્રકાશ યાદવ, કમલેશ શંકર, જેજેપીના અનુપ ધાનક, ધોહીના મેવાડી સંદેપ સિંઘ શ્રમ અને રોજગાર વિભાગ, નાગરિક તેમજ ઉચ્ચત વિભાગ, લોક નિર્માણ વિભાગ, વિકાસ તેમજ પંચાયત વિભાગ, સારાનત સંક્રમણ વિભાગ, પુનવસ વિભાગ જેવા વિભાગ આપ્યું છે. જ્યારે ગૃહ, નાણાં, કૃષિ, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ જેવા મહત્વનાં વિભાગ ખીજીથી પાસે રહેશે.

ન્યુ દિલ્હી, તા. ૧૪ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંઘ ભદોરિયાએ ઝૂંટો એવિયન ટેન્ડર એરક્રાફ્ટથી ઉડાન ભરી હતી. એક કલાકની ઉડાન દરમિયાન તેમણે વિમાનની થમસાઓનું પરિણલ ક્યું હતું. કોઈપણ વિમાનનાં પ્રોટોટાઈપમાં ઉડાણ ભરવાવાળા તેઓ દેશનાં પ્રથમ વાયુસેના પ્રમુખ બન્યા છે. આ ટેન્ડર એરક્રાફ્ટને સિદ્ધાનત એવરોનિક્સ લિમિટેડે બનાવ્યું છે. તેની પ્રથમ ઉડાણ ૩૧ મે ૨૦૧૯નાં રોજ નક્કી કરવામાં આવી હતી. અન્યાર સુધી તેનાં બે પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યા છે. શરૂઆતનાં ડિઝાઈનમાં બનેલા યોડાને પ્રોટોટાઈપથી ઓ બધવામાં આવે છે. રાકેશકુમાર સિંઘ ભદોરિયા

Advertisement for Axel Polymers Limited, featuring a logo, contact information, and a detailed financial statement table for the quarter ended 30.09.2019. The table includes columns for Particulars, Quarter Ended, Half Year Ended, and Year Ended, with sub-columns for Unaudited and Audited figures. It lists various financial metrics like Total Income, Net Profit, and Equity Share Capital.

Advertisement for Panchmahal Steel Limited, featuring a logo and a detailed financial statement table for the quarter and half year ended 30th September, 2019. The table includes columns for S.No., Particulars, Quarter ended, Half Year ended, and Corresponding 3 months ended, with sub-columns for Unaudited and Audited figures. It lists various financial metrics like Total Revenue, Net Profit, and Equity Share Capital.